

# જ્યોત્ષ્ણા આઈ ગાંધીનગર

NEWS OF GANDHINAGAR (Daily) દૈનિક

E mail - prdpraval@yahoo.co.uk

\*Editor : Pradip A. Raval (Mo) 98246 53073 \* Block No.677/2, Gh Type, Sector - 8, Gandhinagar (Gujarat)

\* Volume : 6 \* Issue No. 187 \* Date: 05.05.2022 Thursday \* Page :04 \* Rs. 1.00/- \* Annual Rs. 351/-

બંને દેશો વચ્ચે વ્યાપાર, ઉર્જા સહિત મુદ્દે ચર્ચા થઈ

## પીએમ મોદીએ આઈસલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત

(એ.આર.એલ.)કોપેન્હેન, ડા.૪ પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોના વિદેશ પ્રવાસે છે. આજે ડેનમાર્કની રાજધાનીમાં પીએમ મોદીએ આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જૅકબ્સડોટ્ટર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન દરમિયાન બંને નેતાઓએ ઉર્જા, મત્સ્ય પાલન, વ્યાપાર જેવા ક્ષેત્રોમાં સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા પર વાત કરી હતી. પીએમ મોદી મંગળવારે ડેનમાર્કની રાજધાની પહોંચ્યા હતા. પીએમ મોદીએ ભારત નાર્દિક શિખર સંમેલનમાં પણ હાજરી આપી હતી.

ઈકોનોમી, આર્કિટક, ડિજિટલ યુનિવર્સિટીઓ અને સંસ્કૃતિ સહિતનું શિક્ષણના ક્ષેત્રમાં આર્થિક સહયોગને વધુ મજબૂત કરવા વિશે વાતચીત કરી છે. મહત્વનું છે કે જિયોથર્મલ ક્ષેત્રમાં આઈસલેન્ડની વિશેષતા છે. બંને દેશોએ વિશ્વવિદ્યાલયો વચ્ચે સહયોગ વધારવા પર ભાર આપ્યો હતો. બંને દેશોના પ્રધાનમંત્રીઓએ પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાઓ પર પણ ચર્ચા કરી હતી.



મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા-યુકેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુરોપના દેશોની મુલાકાતે પહોંચ્યા છે. આ ઘટનાએ રશિયા વિરુદ્ધ યુરોપના દેશોને એક કરી દીધા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે જૅકબ્સડોટ્ટરના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમણે આ મામલામાં ભારતની પ્રગતિ વિશે જાણકારી આપી હતી. બંને દેશોના નેતાઓએ ભારત યુરોપીય મુક્ત વ્યાપાર સંઘ વ્યાપાર વાર્તામાં તેજ લાવવા પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ અને ઉર્જામાં આર્થિક સંબંધને મજબૂત કરવાનો માર્ગ ખુલ્યો છે. ભારતે પોતાને ત્યાં જિયોથર્મલ ઊર્જામાં સહયોગી પરિયોજનાનું સ્વાગત કર્યું છે. બંને નેતાઓએ આર્કટિકમાં સહયોગ પર ચર્ચા કરી છે.

યુરોપના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની મુલાકાત અંગે દ્વિટી કર્યું છે. તેમણે પીએમ ફેડરિક્સેન સાથેની વાતચીત અને ભારતીય સમુદાયના લોકો સાથેની મુલાકાત સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. પીએમ મોદી તેમના ત્રણ દેશોના યુરોપ પ્રવાસ દરમિયાન ડેનમાર્ક રોજ ડેનમાર્ક પહોંચ્યા હતા. દ્વિવટમાં પીએમ મોદીએ લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની મુલાકાત અંગે દ્વિટી કર્યું છે. તેમણે પીએમ ફેડરિક્સેન સાથેની વાતચીત અને ભારતીય સમુદાયના લોકો સાથેની મુલાકાત સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. પીએમ મોદી તેમના ત્રણ દેશોના યુરોપ પ્રવાસ દરમિયાન ડેનમાર્ક રોજ ડેનમાર્ક પહોંચ્યા હતા. દ્વિવટમાં પીએમ મોદીએ લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની મુલાકાત અંગે દ્વિટી કર્યું છે.

આર્થિક સંબંધો પર ચર્ચા થઈ, લોકો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે એક સામુદાયિક કાર્યક્રમમાં હાજરી આપી અને ડેનમાર્કના શાહી પરિવાર સાથે મુલાકાત થઈ. આ ગઈકાલની હાઈલાઈટ્સ હતી. પીએમ મોદીએ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વડાપ્રધાન મેટ ફેડરિક્સેન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ પરસ્પર વેપાર અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા-યુકેન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના મુદ્દા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ભારત શક્ય તેટલું જલદી યુદ્ધ સમાપ્ત કરવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવાના પક્ષમાં છે. બંને દેશો વચ્ચે કુલ ૮ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આમાં, સ્વચ્છતા અને ગતિશીલતા, કૌશલ્ય વિકાસ, વ્યાવસાયિક શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જા નીતિ પર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોપનહેગનમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને સંબોધિત કર્યા. પીએમ મોદીના આ કાર્યક્રમમાં ભારતીય મૂળના લગભગ ૧ હજાર લોકોએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને બિઝનેસમેન સામેલ હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોર્વેના પ્રધાનમંત્રી મહામલિમ શ્રીમાન જોનાસ ગહર સ્ટોર સાથે રજી ઈન્ડિયા નોર્ડિક સમિટીની સાથે સાથે કોપનહેગનમાં મુલાકાત કરી હતી. ઓક્ટોબર ૨૦૨૧માં પ્રધાનમંત્રી સ્ટોર દ્વારા કાર્યભાર સંભાળ્યા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. બંને પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોમાં ચાલી રહેલી ગતિવિધિઓની સમીક્ષા કરી અને ભવિષ્યના સહયોગના ક્ષેત્રો પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નોર્વેની કુશળતા અને ભારતના કાર્યક્ષેત્રે કુદરતી પૂરકતા પ્રદાન કરી છે. બંને નેતાઓએ બ્લુ ઈકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ્સ, ગ્રીન શિપિંગ, ફિશરીઝ, વોટર મેનેજમેન્ટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સ્પેસ કોઓપરેશન, લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ, હેલ્થ અને કલ્ચર જેવા ક્ષેત્રોમાં જોડાણને વધુ ગાઢ બનાવવાની સંભાવના અંગે ચર્ચા કરી હતી. પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ ચર્ચા થઈ. યુએનએસસીના સભ્યો તરીકે, ભારત અને નોર્વે પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર યુએનમાં એકબીજા સાથે સંકળાયેલા છે.

## ભારતે નેપાળમાં તેના નવા રાજદૂત તરીકે નવીન શ્રીવાસ્તવને નિયુક્ત કર્યા

નવીદિલ્હી, ડા.૪ ભારતે નેપાળમાં તેના નવા રાજદૂત તરીકે નવીન શ્રીવાસ્તવને નિયુક્ત કર્યા છે. નવીન હાલમાં વિદેશ મંત્રાલયમાં પૂર્વ એશિયા વિભાગના વડા છે. તેમને ચીન સાથે સંબંધિત બાબતોમાં નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે વાસ્તવિક નિયંત્રણ રેખા પરના સ્ટેન્ડ-ઓફનો સામનો કરવા માટે ચીન સાથે રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમને એવા સમયે નેપાળના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી થોડા દિવસો પછી ત્યાં જવાના છે. પાડોશી દેશ નેપાળમાં ચીનના વધતા પ્રભાવ માટે કટ બનાવવાના દષ્ટિકોણથી પણ નવીનની નિમણૂક

મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નવીન શ્રીવાસ્તવ નેપાળના રાજદૂત તરીકે વિનય ક્વાત્રાનો સ્થાન લેશે, જેઓ આ મહિને વિદેશ સચિવ બન્યા છે. નવીનને ભારત તરફથી રાજદૂત તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ નેપાળ મોકલવામાં આવ્યો છે. નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા તેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. નવીન ૧૯૮૩ બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. તેઓ હાલમાં વિદેશ વિભાગના વડા છે જે ચીન, જાપાન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા અને મંગોલિયા સાથે વ્યવહાર કરે છે. ચીન મામલાના નિષ્ણાત નવીન શાંધાઈમાં કોન્સલ જનરલ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેઓ

રોજ લુમ્બીની જવાની યોજના ધરાવે છે. ત્યાં તેઓ નેપાળી સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળશે. જો કે ભારત કે નેપાળે હજુ સુધી આ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી નથી. દેઉબા ગયા મહિને ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. ત્રણ દેશોના યુરોપીયન પ્રવાસ પછી મે મહિનામાં મોદીની આ બીજી વિદેશ યાત્રા હશે. ૨૦૧૪માં પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી ચાર વખત નેપાળ ગયા છે. જો કે, ૨૦૧૯માં બીજી વખત વડા પ્રધાનની ખુરશી સંભાળ્યા પછી અને કોરોના રોગચાળાની શરૂઆત પછી આ તેમની પ્રથમ નેપાળ મુલાકાત હશે. પીએમ મોદીની આ પ્રસ્તાવિત મુલાકાત અને નવીન

## આરબીઆઈએ બે વર્ષ બાદ રેપો રેટમાં વધારો કર્યો, હોમ, ઓટો સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે

મુંબઈ, ડા.૪ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોટો ઝટકો આપ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આજે બે વર્ષથી મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન શક્તિકાંત દાસે રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. રેપો રેટમાં એક સાથે ૪૦ બેસિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ રેપો રેટ વધીને ૪.૪૦ ટકા થયો છે. રેપો રેટ વધવાની સાથે જ હવે તમામ પ્રકારની લોન મોંઘી થશે. અમેરિકા તરફથી વ્યાજદરમાં વધારાની જાહેરાત પહેલા આરબીઆઈનું આ પગલું ભારતીય શેર બજારને હેરાન કરનારું છે. બીજી તરફ આરબીઆઈના ગવર્નરનું કહેવું છે



રેપો રેટ યથાવત રાખ્યો હતો. રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જે દરે દેશની તમામ બેંકોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેંકોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચૂકવવું પડે. જો આ દર વધે તો બેંકોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચૂકવવો પડે.

## વીજ સંકટ ટાળવાના પ્રયાસમાં 'નમકની અછત' સર્જવાના ભાણકારા

નવીદિલ્હી, ડા. ૪ નમક ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું છે કે અગાઉ મીઠાના પરિવહન માટે દરરોજ ૮ રેક આપવામાં આવતી હતી. રેલવે મંત્રાલયે હવે કચ્છના અધિકારીઓને એવી સૂચના આપી છે કે ઉત્તર ભારતના ઈવીજ મથકો માટે કોલસા પહોંચાડવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. વાસ્તવમાં ૭૫ ટકા ઔદ્યોગિક અને ખાદ્ય નમક કચ્છથી જ સપ્લાય થાય છે. એક માલગાડીની એક રેકમાં ૨૭૦૦ ટન નમક સપ્લાય કરવામાં આવે છે. ઔદ્યોગિક નમકની ક્ષમતા ૩૦૦૦ ટનની હોય છે. કચ્છમાંથી વર્ષે ૨.૮૬ કરોડ ટન નમકનું ઉત્પાદન થાય છે જેમાંથી ૨ કરોડ ટન નમકની સપ્લાય ખાદ્ય અને ઔદ્યોગિક વપરાશ માટે થતી હોય છે. ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશનનાં

## ભારતમાં કોરોનાના એકસઈ વેરિઅન્ટનો પ્રથમ કેસ આવ્યો

નવીદિલ્હી, ડા.૪ ભારતમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે અને દેશમાં દરરોજ ૨ હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન ભારતમાં કોવિડ-૧૯ના ઈઈ વેરિઅન્ટનો પુષ્ટિ થયેલો કેસ સામે આવ્યો છે. આ માહિતી ભારતીય સિક્વેન્સિંગ કન્સોર્ટિયમના નવા બુલેટિનમાંથી બહાર આવી છે. જો કે ૨૫ એપ્રિલના મંગળવારે બહાર પાડવામાં આવેલા બુલેટિનમાં તે જાણી શકાયું નથી કે આ પ્રકાર દેશના કયા ભાગમાં આવ્યો છે. આ વર્ષે ૧૯ જાન્યુઆરીએ બ્રિટનમાં કોરોનાવાયરસ એકસઈ વેરિઅન્ટનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ઈઈ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટ કરતાં ૧૦ ગણું વધુ ચેપી છે અને લોકોને ઝડપથી પકડે છે. કોરોના વાયરસનું ઈઈ વેરિઅન્ટ ભારત

## સતત હીટવેવને કારણે ૧૨૨ વર્ષમાં ત્રીજી વખત એપ્રિલ ગરમ મહિનો

નવીદિલ્હી, ડા.૪ સતત હીટવેવને કારણે ભારતમાં ૧૨૨ વર્ષમાં એપ્રિલ મહિનો ત્રીજી વખત ગરમ મહિનો રહ્યો હતો. એપ્રિલ મહિનામાં તાપમાન એટલું ઊંચું રહ્યું કે દેશનાં ૧૧ હવામાન મથકોએ તાપમાનનાં તમામ રેકોર્ડ તૂટ્યા હતા. માર્ચ મહિનામાં પણ અગાઉનાં વર્ષો કરતા તાપમાન ઘણું ઊંચું રહ્યું હતું અને ગરમી જોવા મળી હતી. એપ્રિલમાં ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ, વિદર્ભ અને કેટલાક રાજ્યોમાં તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ રહ્યું હતું. ગયા

## સતત હીટવેવને કારણે ૧૨૨ વર્ષમાં ત્રીજી વખત એપ્રિલ ગરમ મહિનો

મહિને સરેરાશ મહત્તમ તાપમાન ૩૩.૯૪ ડિગ્રીને બદલે સરેરાશ ૩૫.૩૦ ડિગ્રી રહ્યું હતું. ૧૯૦૧ પછી અગાઉ બે વખત એપ્રિલ મહિનામાં વધુમાં વધુ ગરમી નોંધાઈ હતી. ૨૦૧૦માં સરેરાશ માસિક તાપમાન ૩૫.૪૨ ડિગ્રી અને ૨૦૧૬માં ૩૫.૩૨ ડિગ્રી નોંધાયું હતું. એપ્રિલમાં આ વર્ષે લઘુત્તમ તાપમાન ૨૩.૫૧ ડિગ્રી રહ્યું હતું. જે ૧૯૦૧ પછી ૨૦૧૦ કરતા બીજી વખત ૧.૩૬ ડિગ્રી ઓછું નોંધાયું હતું. જરૂર કરતા ઓછા વરસાદને કારણે આ વર્ષે અસહ્ય ગરમી પડી હતી. આમ ગરમીનું ઊંચામાં ઊંચું તાપમાન અને લઘુત્તમ તાપમાન એમ બંનેનાં નવા રેકોર્ડ બન્યા હતા. હવામાન ખાતાએ દેશનાં દસથી વધુ રાજ્યોમાં મંગળવાર પછી ગરમી ઘટવાની અને હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. શુક્રવાર સુધી જે રાજ્યોને ગરમીમાં રાહત મળશે તેમાં જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને દક્ષિણનાં તમામ રાજ્યોનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં તાપમાનનાં ૪ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.







# પાલનપુરના સુંઢામાં ઘરમાં પુરેલી મહીલાને છોડવા ગયેલ ૧૮૧ મોબાઈલ વાનની ટિમ પર હુમલો.

બનાસકાંઠા બ્યુરો  
રિપોર્ટ : દીલીપ ગોહીલ

પાલનપુરના સુંઢા ગામે એક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ પણ યુવતીના પરિવારજનો સમાજમાં અન્ય લગ્ન કરવા માટે યુવતીને ઘરમાં પુરી બળજબરીપૂર્વક લગ્ન કરાવવા માંગતા હોવાથી યુવતી તેના પરિવારના સુંઢાલમાંથી છૂટવા માટે ૧૮૧ની ટીમને જાણ કરતા ૧૮૧ની ટીમને જાણ કરતા ૧૮૧ની ટીમ ઘરમાં પુરેલી હતી. જે બાદ ૧૮૧ની ટીમએ મહિલાને ઘરમાંથી બહાર નીકળી તેના પરિવારના સુંઢાલમાંથી છોડવા જતા ૧૮૧ની ટીમ પર યુવતીના પરિવારે હુમલો કર્યો હતો. મહિલા પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી, ઝપાઝપી કરવામાં આવી હતી અને યુવતીને તેના પરિવારે ૧૮૧ મહિલા હેલ્પલાઈન પાસેથી બળજબરીપૂર્વક યુવતીનું અપહરણ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ મહિલા કોન્સ્ટેબલ મમતાબેનને ગઢ પોલીસ મથકે સુંઢા ગામના સરપંચ અને યુવતીના સગા સહિત ૧૩ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાંઢા ગામ ખાતે એક મહિલાએ પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતીના પરિવાર તેના અન્ય લગ્ન કરાવવા માટે યુવતી સાથે મારઝૂક કરી યુવતીને ઘરમાં પુરી દીધેલ

# બે પગાને લીધે ચોપગા ગઘેડાની વસ્તીમાં ૭૧% ઘટી ગઈ!!!

“ગિરધરભાઈ શું થવા બેઠું છે?” રાજુ રદીએ મને સવાલ કર્યો.  
“રાજુ, દેશમાં એકતા કપૂરની ઘારાવાહિકની જેમ હમે હમે પેટ્રોલ ડિઝલનો ભાવ વધે છે. લોકો આ વિકાસના વિકાસનો આનંદ લઈ રહ્યા છે” મેં ઠંડા કલેજે જવાબ આપ્યો.  
“એમ નહીં. ગિરધરભાઈ” રાજુએ નારાજગી દર્શાવી.  
“રાજુ, રશિયાએ યુકેનેને ખોખરું કરી નાંખ્યું છે. યુકેને પેલી વાર્તા જેમ ડુંગળી કે ખાખી, ચાબખા ખાખા. હવે વિધોદી ભરશે. થીના ઠામમાં ધી પડી જશે. ઝેલેન્સકીએ લાંબી લડાઈ લડીને પુતિનને ધૂળચાટતો કરી દીધો “મેં યુધ્ધસ્ય રમ્યાઃકથા માંડી.  
“મારા સવાલનો આ જવાબ નથી!!” રાજુએ લગભગ ચીસ પાડી.  
“રાજુ. દેશમાં ગરમી પડવા માંડી છે. ગરમીનો પારો ડર ને કોસ કરવા માંડ્યો છે. માર્ચમાં આ હાલ છે તો મે-જૂનમાં કેવા હાલ થશે તેના ચિંતા થવા માંડી છે.” મેં હવામાનની ચિંતા કરવા માંડી.  
“ગિરધરભાઈ. મારી ધીરજની કસોટી ન કરો. નહીંતરપપપ” રાજુએ મને અલ્ટીમેટમ આપ્યું.  
“રાજુ. ઈમરાનખાનનું પ્રધાનમંત્રી તરીકેનું ભાવિ આજે નક્કી થઈ જશે. કદાચ નવાજ શરીફના નાના ભાઈ હવે પછીના પ્રધાનમંત્રી થશે.” મેં ટીડા જોશીની જેમ ઈમરાનનું ટીપ્પણું ખોલી આગાહી કરી.  
“ ગિરધરભાઈ. દેશના બ્રિનિંગ પ્રોબ્લેમની

વાત કરું છું. તમે નીરોની જેમ ફીડલ વગાડો છો.” રાજુએ મને ધમકાવી નાંખ્યો.  
“ રાજુ . સોરી!બોલ તારે શું કહેવું છે?” મેં ગંભીરતા ધારણ કરી કહ્યું.  
“ ગિરધરભાઈ. ગુજરાતમાં એક તરફ એશિયાટિક સિહની સંખ્યા સતત વધી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં ગઘેડાઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં ઘટાડો ૭૦.૮૪ ટકા થયો છે. બ્રુક ઈન્ડિયા ચેરિટી દ્વારા કરાયેલા સર્વેમાં આ સમગ્ર માહિતી સામે આવી છે. ગુજરાતમાં ગઘેડાની વસ્તી ૨૦૧૨માં ૩૮,૦૦૦ હતી. જે ૨૦૧૯માં ધટીને સંખ્યા ૧૧,૦૦૦ની થઈ છે.”રાજુએ આઘાતજનક વાત કરી.  
“ જો, રાજુ. આમાં મારો કોઈ દોષ કે વાંક નથી!!” મેં સ્પષ્ટતા કરી  
“ તમારો વાંક નથી કાઢતો. પણ ગઘેડાની વસ્તી ઘટવાનું કારણ હશે કે નહીં??”  
રાજુએ સવાલ પૂછ્યો.  
“ રાજુ. આ ઘટાડા પાછળ ગઘેડાની ઘટતી જતી, ઉપયોગિતા, ચરાઈ જમીનની તંગી, ગઘેડાની ચોરી અને ગેરકાયદેસર કતલને પતનનાં કારણો તરીકે દર્શાવ્યા છે. પહેલા ૩૦૦૦ થી ૪૦૦૦ હજારમાં ગઘેડા મળતા હતા. જે હવે ૧૭૦૦૦ થી ૧૮૦૦૦ હજારમાં ગઘેડા મળી રહ્યા છે. જેના કારણે ગરીબ લોકોએ ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વેપારીઓ લંગડા, લુલા, ઘાયલ ગઘેડાની મોં માંગી

કિંમત એટલે કે ૧૦,૦૦૦- ૧૫,૦૦૦ કિંમત આપી લઈ જાય છે. જેમને કતલ માટે ફક્ત ગઘેડાથી મતલબ હોય છે. સાક્ષરતા દરમાં વધારો, ઈટોના ભક્ષમાં યાંત્રિકરણ અને માલસામાનની વહન માટે ગઘેડાને બદલે ખચ્ચરનો ઉપયોગ પણ તેમની વસ્તીમાં ઘટાડા માટેના કારણો પૈકી એક છે. ગઘેડાની ચામડીની દાણચોરી અન્ય દેશોમાં, ખાસ કરીને ચીન, ઈજિપ્તમાં માટે કરવામાં આવે છે, જેનો ઉપયોગ વિવિધ રોગોની સારવારમાં થાય છે. ગઘેડાનું માંસ ખાવાથી શ્વાસની બીમારી દૂર થાય છે. તેમને એવો પણ વિશ્વાસ છે કે ગઘેડાનું માંસ ખાવાથી સેક્સ પાવર વધે છે. આ ધારણાઓને કારણે લોકો ગઘેડાનું માંસ ભોજનમાં ઉપયોગમાં લે છે. ધેડાના શરીરમાં રહેલું જિલેટીન અથવા તેની ચામડીને પલાળીને અને સ્ટીવિંગ કરીને તેમાંથી મેળવવામાં આવતું એક પ્રકારનું ગુંદર છે. ‘એજિયાડો’ એ પરંપરાગત ચાર્નીઝ દવામાં ક્લિડિંગ, ચક્કર, અનિદ્રા અને સૂકી ઉધરસ જેવી વિવિધ પ્રકારની બિમારીઓની સારવાર માટે વપરાતો ઘટક છે. xઆ ઉપરાંત તેના કેટલાક બીજા પણ આરોગ્યદાયક લાભ હોવાનું કહેવાય છે. તેમાં આયુષ્ય લંબાવવા, સેક્સ ડ્રાઇવમાં વધારો કરવા અને સુંદરતા જાળવી રાખવા માટેના ગુણ હોવાનું માનવામાં આવે છે અને આ કારણે હવે ચીનમાં વધતા મધ્યમ વર્ગની માંગમાં વિસ્ફોટ જોવા મળ્યો છે. ‘એજિયાડો’ ની બેફામ માંગના કારણે પહેલાથી જ ચીનમાં ગઘેડાની વસ્તીને ખતમ થઈ ચૂકી છે. પરંતુ હવે વિકાસશીલ આફ્રિકન અને એશિયન દેશો કે જ્યાં ઘણાં લોકોની આજીવિકા પણ ગઘેડા પર જ આધાર રાખે ત્યાં પરિસ્થિતિ ચિંતાજનક છે. “મેં રાજુને વિગતવાર જવાબ આપ્યો.  
“ ગિરધરભાઈ. બે પગાળા ગઘેડાની સંખ્યા વધી છે. કેટલાક તો વિધાનસભા કે સંસદમાં પહોંચ્યા છે. બે પગાને લીધે ચોપગા ગઘેડાની વસ્તી ઘટી છે!!!”  
હું “હૈં હૈં શું કીધું” તેમ કહી રચૂચકર થઈ ગયો!!!  
ભરત વૈષ્ણવ  
૩૧.૩.૨૦૨૨.

# જીવાત્માની ચાર રાણીઓ

એક રાજાને ચાર રાણીઓ હતી. પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો. બીજી નંબરની રાણી બહુ રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર કોઈ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજી નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે, ત્રીજી નંબરની રાણી સાથે થોડું ઓછું બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઈ બાબત પર નિર્ણય લેવાનો હોઈ કે કોઈ મંજૂરણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવતો હતો અને ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય, રાજા તેણે સામેથી ક્યારેય મળવા ના જાય એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાથ હેલ્લો થાય.  
રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતિ કરી ત્યારે પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી. બીજી રાણી તો એથી એક ડગલુ આગળ હતી, એણે તો એવું કહ્યું કે સાથે આવવાની ક્યાં વાત કરો છો? હું તો તમારી વિદાય થતા તુરંત જ બીજા લગ્ન કરી લઈશ. ત્રીજી રાણીએ કહ્યું કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પણ હું તમારી સાથે નહીં આવી શકું. રાજાને ચોથી રાણી પાસેથી તો કોઈ અપેક્ષા હતી જ નહીં પણ ચોથી રાણીએ સામેથી કહ્યું કે તમે મને ના પાડશો તો પણ હું તમારી સાથે જ આવીશ. આપણે બધાના જીવનમાં પણ આપણે આ ચાર રાણીઓને પરણ્યા છીએ. પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખુબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. બીજી રાણી તે આપણી બંધન-સંપત્તિ, બંગલા મોટરગાડી, પદ-પ્રતિષ્ઠા અને પૈસો કે જેને ઘરની બહાર આપણે બીજાને દેખાડવામાં પ્રદર્શન કરવામાં ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાય થતાં જ તે સંપત્તિ બીજાની

પ્રભુની અમાનત અને પારકો માલ સમજીને તેનો ઉપભોગ કરવો જોઈએ. તન, મન અને ધનમાં પોતાપણાનો ત્યાગ નિશ્ચિંતરૂપથી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃદ્ધિ કરે છે, જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે. જગતમાં જે કંઈ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉપભોગ કરવો અને કોઈના પણ ધન ઉપર લલચાવવું નહીં. મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી. સેવા સુમિરણ સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ છે. તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળ ભાવથી ભક્તિ પથ ઉપર આગળ વધી શકાય છે. સગાં-સબંધીઓ તમામ સ્વાર્થના સગા છે, ઈનિયાતા તમામ સગપણ જૂઠા છે, ધન-વૈભવને ઢળતી છાયા જેવા છે, આપણો સાચો સાથીદાર, ભવસાગરની નૌકાનો સાચો સુકાની પ્રભુ પરમાત્મા છે. મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઈ જીવન સાથે જતા નથી. જીવ પોતાના સારા-નરસા કર્મો. મન અને ઈન્દ્રિયોના સુક્ષ્મ રૂપ સહિત પહેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે. જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઈ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં પડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઈએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ પછી દુઃખદાયી થાય. સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે. નિઃસ્વાર્થભાવથી સંસારમાં રહીને ભલે પોતાનો કારોબાર કરો. પોતાના પરીવાર તથા સબંધીઓની સાથે તેમને ઈશ્વરનું સ્વરૂપ સમજી અનાસ્કત થઈને પ્રેમ કરો પરંતુ ઈશ્વરને ક્યારેય ના ભૂલવા જોઈએ કારણ કે આ માયાવી સંસારમાં તો થોડા સમય માટે જ રહેવાનું છે, છેલ્લે તો એક પ્રભુ પરમાત્મામાં જ સમાવવાનું છે. દરેક સમયે અંગસંગ રહેવાવાળા પરમાત્માનું ધ્યાન કરતા રહો. સંતોનું સર્વશ્રેષ્ઠ ઉપહાર છે. આ દેહને

# અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે ‘થેલેસેમીયા-ડે’ તા. ૮, મે, રવીવાર, સાંજે આનંદોત્સવ’ થેલેસેમીયા પીડીત બાળક જય જીતુલભાઈ કોટેયા (હોટેલ યુરોપા ઈન) પરીવારનો સંપૂર્ણ આર્થિક સહયોગ

અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફૂલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે થેલેસેમીયા-ડે-રવીવાર, તા. ૮, મે, સાંજે ૫-૦૦ થી ૮-૦૦ કલાકે (સમયસર), ‘લોક વિજ્ઞાન કેન્દ્ર’, બાલભવનની બાજુમાં, આર્ટ ગેલેરીની સામે, રેસકોર્ષ, રાજકોટ ખાતે આનંદોત્સવ તથા તમામ થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના પરીવારજનો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમના બધા થેલેસેમીયા પીડીત બાળકોને આમંત્રણનાં સરક્યુલર મોકલાવ ગયા છે છતાં કોઈને કોઈ કારણસર ન મળ્યા હોય તો પણ આ કાર્યક્રમમાં સૌ થેલેસેમીયા પીડીત બાળકોને પરીવાર સહ સમયસર ઉપસ્થિત રહેવા જાહેર

આમંત્રણ અપાયું છે. આ આયોજન અંગે સંપૂર્ણ આર્થિક સહયોગ થેલેસેમીયા પીડીત બાળક જય જીતુલભાઈ કોટેયા (હોટેલ યુરોપા ઈન)નાં પરીવારનો મળ્યો છે. લોકવિજ્ઞાન કેન્દ્રના ડૉ. રમેશભાઈ ભાયાણી કે જેમણે પોતાનું સમગ્ર જીવન આ બાળકોની સેવામાં સમર્પિત કર્યું છે તેઓ પણ સતત આ આયોજનમાં સહકાર આપી રહ્યાં છે. આ કાર્યક્રમમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોભાડ, ડૉ. નિશાંતભાઈ ચોટાઈ તેમજ સમગ્ર ટીમ, સેવાભાવી અગ્રણીઓ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, મુકેશભાઈ દોશી, , કલ્પેશ હરીશભાઈ પલાણ, ઉપેનભાઈ મોદી, હસુભાઈ રાચ્છ, ડૉ. રવી ધાનાણી, , હિમાંશુભાઈ માંકડ, વિનયભાઈ જસાણી સહીતનાઓની શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના સુપ્રિમો અને જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેયા, માર્ગદર્શક મંડળના પદ્મભાઈ રાયચુરા, મહામંત્રીઓ કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા અને જગદીશભાઈ જોબનપુત્રા તેમજ સમગ્ર ટીમ વિવિધ મહાજનો—શાંતિ સંસ્થાઓના સથવારે રહીને xથેલેસેમીયા મુક્ત રઘુવંશx ની દિશામાં સતત પ્રયત્નો કરી રહ્યાં છે. સમગ્ર આયોજન અંગે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણી, થેલેસેમીયા સમિતીના અધ્યક્ષ જીતુલભાઈ કોટેયા, ડૉ. રમેશભાઈ ભાયાણી, જનકભાઈ કોટક, ભરતભાઈ કોટક, દિપકભાઈ રાજણી, ગૌરાંગભાઈ ઠક્કર, નલીનભાઈ તથા, ચંદુભાઈ રાયચુરા, સંજયભાઈ ઠક્કડ અને કનભાઈ હિડોયા, સુરેશભાઈ

# શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કોબા ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી કોબા ખાતે કારણ સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. મહંત સદ્ગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામી, સં. શ્રી શ્રી દિવ્યચરણદાસજી સ્વામી,

કાર્યક્રમમાં પધાર્યા હતા. સં. શ્રી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય અમૃતવાણી વચનામૃતની કથા કરી હતી. જ્યારે મહંત સદ્ગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે માનવજીવનમાં સત્સંગથી ઈશ્વરની પાવર વધે છે, સત્સંગથી શુદ્ધ વિચારો પણ આવે છે અને સંસ્કૃતિ પણ જળવાય છે. મનુષ્યે જીવનમાં સ્નેહ, સંપ રાખી દુઃસંગ અને વ્યસનોને તિલાંજલિ આપવી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી શ્રી મથુરભાઈ પટેલની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

# અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને આરઆઈના પ્રોફેસર ડૉ. કિંજલ પટેલે આયુષ્યોન મેરેથોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું

અમદાવાદ ૪ મે ૨૦૨૨: અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને આરઆઈના પ્રેક્ટિસિંગ વિભાગના પ્રેક્ટિસ ફેકલ્ટી ડૉ. કિંજલ પટેલએ આયુષ્ય(ઇજ્જેઝુકે) દ્વારા ૨૩ અને ૨૪મી એપ્રિલ ૨૦૨૨ ના રોજ રિવરફ્રન્ટ અને કાંકરિયા, અમદાવાદ ખાતે યોજાયેલ આયુષ્યોન મેરેથોનમાં ૪૦-૬૦ વર્ષની મહિલા વય જૂથ વિભાગની ૧૦ કિમી સાયકલિંગ અને ૫ કિમી દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વધુમાં, ડૉ. પટેલે ટીમી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે સંલગ્ન શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર, ગુજરાત દ્વારા આયોજિત નેશનલ સી સ્વિમથોનમાં પણ ૧ કિમી અંતર (૪૦-૬૦ વર્ષની વય જૂથ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તારીખ ૧લી મે ૨૦૨૨, ગુજરાત સ્થાપના દિવસે ડૉ. પટેલે સાયકલ ક્લબ અને કલેક્ટર કચેરી, મહેસાણા દ્વારા વડનગર, ગુજરાત ખાતે આયોજિત ઓપન વોટર ડુકસી સ્વિમિંગ સ્પર્ધામાં ૨૦૦૦ મીટર અને ૮૦૦ મીટરની સ્વિમિંગ રેસમાં પ્રથમ રનર અપ નો ખિતાબ જીત્યો છે. તેમની સિદ્ધિઓની હારમાળામાં વધુ સિદ્ધિ મેળવવા દ્વારા સ્વાર્ણમ યુનિવર્સિટીને ગૌરવ અપાયું છે.

# શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગુપના સથવારે, પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા, પીવાનાં પાણીની ફુંડી, ‘રામપાતર’ અને ગાયોની પાણી પીવાની ફુંડી બારે મહિના નિ:શુલ્ક વિતરણ

૩૦ કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં યુગ દિવાલક પૂ. નમ્રમુનિ મહારાજ ફુંડી રાખી દરરોજ સફાઈ કરી. બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની રામપાતરનું છેલ્લા ઘણા વર્ષોથી, બારે મહિના નિ:શુલ્ક વિતરણ થઈ રહ્યું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઈને તરફડતા હોય છે, ગોંમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ ઝૂપના સંયુક્ત ઉપક્રમે સીમેન્ટની મોટી ફુંડી (સાઈઝ આશરે ૨ ફૂટ બાય ૧.૫ ફૂટ, વજન આશરે



મેળવવા માટે મિતલ ખેતાણી, “સત્યમ” ૩-ટાગોર નગર, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સામે, કોટેયા ચોક, કાલાવડ રોડ, રાજકોટ અને xજનપથx, ૨ - તપોવન સોસાયટી કોર્નર, સરાજા બેકરી પાસે, હોલિડે પ્લાઝા બિલ્ડિંગની સામે, અક્ષર માર્ગ મેઈન રોડ, રાજકોટ ખાતેથી રૂબરૂ લઈ જઈ શકાશે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી (૯૮૨૪૨૨૧૯૮૯), પ્રતિક સંઘાણી (૯૯૯૮૦૩૦૩૦૩), ધનશ્યામભાઈ ઠક્કર, ધિરેન્દ્રભાઈ કાનાબાર, રમેશભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ અને અર્હમ યુવા સેવા ગુપના તુષારભાઈ મહેતા (૯૦૬૭૭૧૨૪૪), સેતુરભાઈ દે સાઈ (૯૮૯૮૨૩૦૯૭૫), ચેતનભાઈ મહેતા (૯૮૭૯૮૦૯૪૪૨૬), તેજસભાઈ બાવીશી (૯૪૨૯૫૦૨૪૪૬), જશ્મીભાઈ શાહ (૯૮૨૫૪૮૭૭૯), નિરવભાઈ અજમેરા (૯૮૨૪૩૭૨૧૯૦) તેમજ ટીમ જહમત ઉઠાવી રહી છે.



# પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પરભુદાદાના સાનિધ્યમાં નાસિક ગોદાવરી તટે ભવ્યાતિભવ્ય ૧૦૦૮ કુંડી શ્રીરામ જ્યોતિ મહાયજ્ઞ યોજાયો

નવસારી પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં અખાત્રીજના અતિ પાવન દિવસે પુણ્યશાળી નાસિક તીર્થ ક્ષેત્રે પવિત્ર ગોદાવરી નદી કિનારે ભવ્યાતિભવ્ય ૧૦૦૮ કુંડી શ્રીરામ જ્યોતિ મહાયજ્ઞ યોજાયો હતો. પ્રગટેશ્વર ધામના ગૌર મહારાજ અનિલભાઈ અને કશ્યપભાઈ તેમજ હર્ષ સહિત નાસિકના બ્રાહ્મણોની ટીમે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યજ્ઞ કાર્યને સંપન્ન કરાવ્યું હતું. આ શુભ કાર્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાત શિવ પરિવારના હજારો શિવભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા હતા.

આ યજ્ઞનું ધજ્જરોહણ રામનવમીના પવિત્ર દિવસે કરાયું હતું. જ્યારે ધાર્મિક કાર્યોમાં વિધ્નો નાખવા આવતી આસુરી શક્તિઓ સામે રક્ષણ આપી યજ્ઞ કાર્ય વિના વિધ્ને પૂર્ણ થાય તેમજ ધર્મની રક્ષા માટે ભગવાન શ્રીરામના આશીર્વાદ મળે તેવા શુભ આશયથી બે દિવસ અગાઉ યજ્ઞ મંડપમાં ધજ્જરોહણ કરાયું હતું.

યજ્ઞની પૂર્વસંધ્યાએ નાસિક નગરના મુખ્ય રસ્તાઓ ઉપર ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની ભવ્ય શોભાયાત્રા કાઢી સમગ્ર નાસિક શહેરના નગરજનોને યજ્ઞમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વાચન પાઠવતાં જણાવ્યું હતું કે, ભગવાનની કૃપા

અને માતા પિતાના આશીર્વાદ હોય તેમને જ આવા યજ્ઞમાં સહભાગી બનવાનો અવસર મળે છે. બ્રહ્મ મુહૂર્તમાં કરેલું કાર્ય હંમેશા સફળ જ થાય છે અને તેમાં પણ અક્ષય તૃતીયાના અતિ પાવન દિવસે પવિત્ર નાસિક તીર્થમાં ગોદાવરી નદીના કાંઠે ૧૦૦૮ કુંડી શ્રીરામ યજ્ઞમાં ભાગ લેનારાએ જન્મોજન્મનું પુણ્યનું ભાણું બાંધી લીધું છે. જગતનું કલ્યાણ કરવા ભગવાન શ્રીરામે અવતાર લીધો હતો, જેના પવિત્ર પગલાં અહીં પડ્યા હતા.

આ શુભ અવસરે મહારાષ્ટ્ર શિવ પરિવારના પ્રમુખ આર.કે.ખાંડે અને ગુજરાત શિવ પરિવારના પ્રમુખ બીપીનભાઈ પરમારે ૧૦૦૮ કુંડી શ્રીરામ જ્યોતિ મહાયજ્ઞમાં સહયોગી નામી-અનામી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પવિત્ર યજ્ઞમાં પૂર્વ અધ્યક્ષ અખિલ ભારતીય અખાડા પરિષદ અને પ્રમુખ આનંદ અખાડા ત્ર્યંબકેશ્વરના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સાગરાનંદ સરસ્વતી મહારાજ, કાલારામ રામમંદિર- પંચવટી નાસિકના આચાર્ય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સુધીર મહારાજ, દેશ-વિદેશમાં જાણીતા ખેરગામના કથાકાર ઈશ્વરભાઈ જોષી, જાલના આશ્રમ-આનંદ અખાડા-ત્ર્યંબકેશ્વરના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ગણેશાનંદ સરસ્વતી મહારાજ, આનંદ અખાડા ત્ર્યંબકેશ્વર નાસિકના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ગિરિજાનંદ સરસ્વતી મહારાજ, નશીકના શ્રી

દેશમાં સૌ પ્રથમ વાર લબાસના, મસૂરી અને સ્પીપા, અમદાવાદ દ્વારા આઈ.એ.એસ. દ્વિતિય ચરણના પ્રોફેશનલ કોર્સના એક દિવસનો ટ્રેનિંગ નીડસ એનાલીસીસ વર્કશોપ યોજાયો વડાપ્રધાનશ્રીના મિશન કર્મચોગી અન્વયે વહીવટી સુધારણાના ભાગરૂપે આઈ.એ.એસ. અધિકારીઓ વધુ લોકાભિમુખ બને તે પ્રકારની તાલીમ વ્યવસ્થા ઉભી કરવા માટે ભારત સરકારની લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરીના ડાયરેક્ટર શ્રી કે.શ્રીનિવાસ સક્રિય ભાગ લઈ માર્ગદર્શન આપ્યું હતું. સ્પીપાના મહાનિર્દેશકશ્રી આર.સી.મીના દ્વારા ગુજરાત કેડરના ડિસ્ટ્રીક્ટ ટ્રેનિંગ નીડસ આઈ.એ.એસ. દ્વિતિય ચરણના પ્રોફેશનલ કોર્સના એક દિવસનો ટ્રેનિંગ નીડસ એનાલીસીસ માટેના વર્કશોપનું સ્પીપા અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં

## મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આયોજિત 'સામુદાયિક વાર્ષિકતપ પારણોત્સવ' યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 'સામુદાયિક વાર્ષિકતપ પારણોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ 'સામુદાયિક વાર્ષિક તપ પારણોત્સવ'માં ૨૭૫થી વધુ તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ આચાર્ય શ્રી રત્નાકર સુરિશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. આચાર્ય શ્રી રત્નાકર સુરિશ્વરજી મહારાજ




સાહેબે વાસક્ષેપ કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આશીર્વાચન પાઠવ્યા હતા મુખ્યમંત્રીશ્રી જન જનના કલ્યાણ માટે ભમણી શક્તિથી કામ કરે તેવી મંગલકામના આચાર્ય શ્રી રત્નાકર સુરિશ્વરજીએ વ્યક્ત કરી

# ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના તબીબોએ ૯ કલાકની જહેમતના અંતે ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સફળતા - રાજકોટની શાકભાજી વેચતી ગરીબ મહિલા દર્દીના ગળાની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન

અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેડ એન્ડ નેક ઓફીલોજી વિભાગના તબીબોએ ૯ કલાકની ભારે જહેમત બાદ રાજકોટના શાકભાજી વેચતી ગરીબ મહિલા દર્દી શ્રી સોનલબહેનની ગળા પરની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું.

અમે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેડ એન્ડ નેકના સર્જન શ્રી પ્રિયાંક રાઠોડને પૂછ્યું કે, કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં અનેક ઓપરેશન થતા હોય છે ત્યારે આ ઓપરેશન આખની ટીમ માટે કેમ પડકારરૂપ હતું ? જવાબમાં ડો. રાઠોડ કહે છે : આ કેસમાં દર્દીનું ટ્યુમર ધમની અને શીરાને ચોંટાળેલું હતું અને જો ઓપરેશન દરમિયાન રક્તસ્રાવ થાય તો દર્દીનું મૃત્યુ થવાનું જોખમ રહેલું હતું. આમ, આ



ઓપરેશન ઘણું જોખમી હતું. ડો. પ્રિયાંક ઓપરેશન માટે અન્ય ટીમના સભ્યોને શ્રેય આપતા કહે છે, આ અઘરું ઓપરેશન એનેસ્થેસિયા અને પ્લાસ્ટિક સર્જરીની ટીમ સાથેના સંકલન અને સહયોગના કારણે આ અમે કરી શક્યા.

કાર્ય ઉત્કૃષ્ટ રીતે કર્યું. ગુજરાત કેન્સર રિસર્ચ તબીબી પરિભાષામાં સુપ્રા મેજર સર્જરી તરીકે ઓળખાતી આ સર્જરી વિશે ડો.પ્રિયાંક કહે છે કે, દર્દીના ગળાની ડાબી બાજુએ ૧૮ x ૧૫ x ૬૨ સેન્ટીમીટરની આશરે અઢી કિલોની આટલી મોટી ગાંઠ અગાઉ ક્યારેય કોઈ દર્દીમાં જોવા મળી નથી. વળી, ઉપલબ્ધ તબીબી સાહિત્યમાં પણ આવી ગાંઠ વિશે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.

આ ઓપરેશનને તબીબી ભાષામાં સમજાવતા ડો. રાઠોડ કહે છે કે, આ ગરદન પરની ગાંઠનું નિદાન Malignant Peripheral Nerve Sheath Tumor તરીકે થયું હતું. સરળ ભાષામાં તેને ચેતાતંતુમાં થતું સારકોમા (કેન્સરનો એક પ્રકાર) તરીકે ઓળખાવી શકાય.

## સાણંદ બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.



ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી એવા પરશુરામ ભગવાનની જયંતીની ઉજવણી બ્રહ્મ સમાજે ખૂબ જ ઉત્સાહ સાથે કરી હતી. યુવાનો દ્વારા બાઈક રેલી જય જય પરશુરામ ના ભુવંદ જયઘોષ સાથે બ્રહ્મ સમાજના અગ્રણીઓ પોત પોતાના વાહન સાથે વિશાળ રેલી યોજી હતી. ડી.જે.ના તાલ સાથે સાણંદ બાયપાસ રોડથી વિરમગામ હાઇવે રોડ ઉપર આવેલ શંકર તીર્થ આશ્રમ પહોંચી હતી જ્યાં પરમ વંદનીય સંત શ્રી આનંદમૂર્તિજીના આશીર્વાદ અને તેમની ઉપસ્થિતિમાં ભગવાન પરશુરામ દાદાનું પૂજન અર્ચન અને મહા આરતી કરવામાં આવી હતી. બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ

## ચાણસ્માના રૂપપુર નજીક ઘડીની ટક્કર એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીનું કમાટી ભર્યું મોત

રિપોર્ટ નિખિલ જોશી પાટણ બ્યુરો ચાણસ્માના રૂપપુર નજીક આવેલ કોલેજમાં પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીને સામેથી આવી રહેલી ઈકો ગાડીની ટક્કરથી કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આજરોજ બુધવારના રોજ બીજલ પ્રજાપતિ ઉંમર વર્ષ ૨૨ ને ટી એસ આર કોમર્સ એન્ડ આર્ટ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્યારે પરીક્ષાનું છેલ્લું પેપર હોય પોતાનું એકટીવા નંબર ૨૪ ૮૦ ૮૧ લઈ ચાણસ્મા ખાતે પરીક્ષા આપવા નીકળી હતી અને પરીક્ષાનું પેપર પૂર્ણ થતા પાટણ ખાતે પરત ફરી રહી હતી ત્યારે સામેથી માટેલા સાંઠની સમાન આવી રહેલી ઈકોગાડી દ્વારા રૂપપુર નજીક પૂરડડપે ટક્કર મારતા ઘટનાસ્થળે જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા દે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ પરિવારજનોને જાણ થતા સમગ્ર પરીવારજનો ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ ચાણસ્મા પોલીસને થતાં લાશનું પંચનામું કરી પીએમ ખાતે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે મૂકી વધુ તપાસ ચાણસ્મા પોલીસે હાથ ધરી છે.

## ડાંગી બોય જીવ ગાંગુડે એ દિલ્હી કેપિટલ્સના સમર કેમ્પમા ભાગ લીધો



માર્ગદર્શન હેઠળ આયોજિત દિલ્હી કેપિટલ્સના આ સમર કેમ્પમા છ સેશનમા, ડાંગના આ યુવા ક્રિકેટરે ભાગ લઈ, પસંદગીકારો સમક્ષ તેની ક્ષમતા રજૂ કરી હતી. દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ એકેડમી દ્વારા દિલ્હી કેપિટલ્સ ડેવલોપમેન્ટ સ્કવોડ માટે આયોજિત આ કેમ્પમા શ્રી સબા કરીમ સહિત દેશના અનુભવી ક્રિકેટરો, અને દિલ્હીની રણજીટ ટ્રોફી ટીમના ખેલાડી જોન્ની સિદ્ધુ સહિતના નિવરેલા ખેલાડીઓ દ્વારા પ્રશિક્ષણ મળ્યું હતું. બાલ ભવન ઈન્ટરનેશનલ સ્કૂલ, દ્વારકા (દિલ્હી) ખાતે આયોજિત આ સમર કેમ્પમા પસંદગીકારોની નજરમા આવ્યા બાદ, દિલ્હી કેપિટલ્સ સ્કવોડમા પસંદ થવાની તક રહેલી છે, તેમ ડાંગના આ યુવા ક્રિકેટર શ્રી જીવ ગાંગુડે એ એક મુલાકાતમા જણાવ્યું હતું.

## દંડક અને ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે હરિદ્વાર ગંગા કિનારે ગરીબોને ભોજન કરાવાયું

દાહોદ. તેમજ દંડક ના અંગત ફતેપુરા વિધાનસભા ના મદદનીશ હિતેશ કલાલ દ્વારા ઉત્તરાખંડ ના હરીદ્વાર ગંગા કિનારે ધારાસભ્ય રમેશભાઈ ના જન્મ દિવસ નિમિત્તે તેમનું આયુષ્ય સ્વસ્થ નિરોગી અને તંદુરસ્ત રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે શિવજી ને ગંગાજી નો જળાભિષેક કરાયો હતો. તેમજ ગરીબો ને ભોજન કરાવવામાં આવ્યું હતું.

## શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) ઉત્તર ઝોનમાં બ્રહ્મ ગૌરવ એવોર્ડ



તારીખ: ૨/૫/૨૦૨૨ વાર: સોમવારના રોજ મહેસાણા ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) ઉત્તર ઝોન ખાતે બ્રહ્મ ગૌરવ એવોર્ડ - ૨૦૨૨ યોજાયો. જેમાં મંચસ્થ મહાનુભાવોમાં રાજ્યસભા સાંસદ, શ્રીજુગલભાઈ લોખંડવાલા, રાજ્યના ઉપપ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ

## અમરેલી લોહાણા મહાજન દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક શ્રી રઘુવંશી પરીચય મેળાનું આયોજન

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક, જ્ઞાતિ શ્રેષ્ઠી મનુભાઈ મીરાણી દ્વારા ૨૧ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે 'રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર' ચલાવવામાં આવે છે. અમરેલી લોહાણા મહાજન દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક શ્રી રઘુવંશી પરીચય મેળાનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. આ પરિચય મેળા થકી અનેક જોડીઓ વૈશ્વિક કક્ષાએ પરમાત્માની કૃપાથી સર્જશે તેવો આશાવાદ નિમિત્ત આયોજકોએ વ્યક્ત કર્યો છે.

આ નિ:શુલ્ક પરિચય મેળાનું આયોજન તા. ૧૫/૦૫/૨૦૨૨, રવિવારનાં રોજ માતૃશ્રી અંબાબેન નરસી દાસ સોઢા, લોહાણા મહાજન વાડી, લાઠી બાયપાસ રોડ, અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. સમગ્ર અમરેલીના રઘુવંશીઓનાં શૈક્ષણિક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે અમરેલી લોહાણા મહાજન જ્ઞાતિ સેવા માટે સંગઠનનાં પ્રમુખ જીતુભાઈ સોમૈયા, ઉપપ્રમુખ સતિષભાઈ આડિત્યા, ભાવેશભાઈ સોઢા, જગદીશભાઈ સેલાણી,

રમણીકભાઈ ગઢીયા, ભાવેશભાઈ આડતીયા, ભરતભાઈ સોનપાલ, મનોજભાઈ સોનપાલ સંગઠનને માર્ગદર્શન આપી રહ્યાં છે. યુવક-યુવતીઓ 'લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ' અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષમાં 'થેલેસેમીયા મુક્ત રઘુવંશ, થેલેસેમીયા મુક્ત સમાજ' બને, તથા કમળા ફૂલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિ:શુલ્ક પ્રવેશ અપાઈ રહ્યો છે. વૈવિશાળ માહિતી-માર્ગદર્શન અપાઈ છે. અમરેલી ખાતે યોજનાર નિ:શુલ્ક પરિચય મેળામાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે અમરેલી લોહાણા મહાજનની સલાહકાર સમિતિનાં જીતુભાઈ સોમૈયા (મો. ૯૪૨૬૭૩૫૧૨૭), સતિષભાઈ આડિત્યા, (મો. ૯૮૭૯૦૬૯૭૭૯), ભાવેશભાઈ સોઢા (મો. ૯૮૦૪૭૫૬૫૬૫), રોમીલભાઈ ગઢિયા, (મો. ૭૦૧૬૬૪૫૮૮૫) નો સંપર્ક કરવા મનુભાઈ મિરાણી (મો. ૯૪૨૮૪૬૬૬૬૬૩) ની યાદીમાં જણાવ્યું છે.